

Seat No.:

--	--	--	--	--	--	--

Sl. No. :

100001

207(G)

(May, 2021)

Time : 3 Hours]

[Maximum Marks : 100

સૂચનાઓ :

- 1) આ પ્રશ્નપત્રમાં કુલ 58 પ્રશ્નો છે.
- 2) પ્રશ્નોના જવાબ સૂચના મુજબ આપો.
- 3) પ્રશ્નોની સામે લખેલ અંક ગુણ દર્શાવે છે.
- 4) નવો વિભાગ નવા પાના પર લખો.

વિભાગ - A

- નીચે આપેલા 1 થી 15 બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો છે. દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરી લખો. દરેકનો 1 ગુણ છે.

[15]

- 1) આબકારી જકાત એ કયાં પ્રકારનો વેરો છે ?
(A) પ્રત્યેક્ષ વેરો
(B) પરોક્ષ વેરો
(C) જકાત વેરો
- 2) ઓડિટ દરમ્યાન ઉપસ્થિત થતા મુદ્દાની નોંધ રાખવા માટે ઓડિટર શું રાખે છે ?
(A) ઓડિટ અહેવાલ
(B) ઓડિટ કાર્યક્રમ
(C) ઓડિટર નોંધ પોથી
- 3) કર્મચારીઓના કાર્યનું વિભાજન કરવામાં આવે છે.
(A) આંતરિક અંકુશથી
(B) ચકાસણીથી
(C) વાઉચિંગથી

- 4) લોટરીની આવક એ કયા પ્રકારની આવક છે ?
- (A) મૂડીનફાની આવક
(B) ધંધા-વ્યવસાયની આવક
(C) આકસ્મિક આવક
- 5) નીચેનામાંથી કઈ પ્રક્રિયાને ઉત્પાદન ગણી શકાય ?
- (A) દુધમાંથી માવો બનાવવાની ક્રિયા
(B) કોટનવેસ્ટને શુદ્ધ કરવું
(C) ફાનસમાં દિવેટ નાંખવી
- 6) અમુક વ્યવહારની ઉદ્ભવથી માંડીને છેવટ સુધીની તપાસ એટલે
- (A) અંશતઃ ઓડિટ
(B) સંપૂર્ણ ઓડિટ
(C) ઉંડાણપૂર્વક ઓડિટ
- 7) આકારણી વર્ષનો સમયગાળો કેટલો હોય છે ?
- (A) 11 માસ
(B) 12 માસ
(C) 13 માસ
- 8) આંતર રાજ્ય વેપાર કે વાણિજ્યમાં ખાસ અગત્યતા ધરાવતો માલ એટલે
- (A) પ્રતિબંધિત માલ
(B) જાહેર કરેલો માલ
(C) માલ
- 9) પ્રાયોગિક તપાસમાં ઓડિટર કયાં પ્રકારના વ્યવહારોની પસંદગી કરે છે ?
- (A) ફક્ત ખરીદીના
(B) કસોટીરૂપ
(C) ફક્ત વેચાણના

- 10) એ કળા અને વિજ્ઞાન બન્ને છે.
- (A) ઓડિટિંગ
(B) અન્વેષણ
(C) મૂલ્યાંકન
- 11) ઓડિટર એ કંપનીનો કોણ છે ?
- (A) માલિક
(B) અધિકારી
(C) પ્રતિનિધિ
- 12) ઓડિટ અહેવાલ કોને સંબોધી લખાયેલો હોવો જોઈએ ?
- (A) માલિક
(B) શેર હોલ્ડરો
(C) ડિરેક્ટર
- 13) બધા જ વ્યવહારોની વિગતવાર તપાસ કરવામાં આવે છે ?
- (A) નિત્ય તપાસ
(B) પ્રાયોગિક તપાસ
(C) અણધારી તપાસ
- 14) આવકવેરો કોણ ઉઘરાવે છે ?
- (A) નગરપાલિકા
(B) રાજ્ય સરકાર
(C) કેન્દ્ર સરકાર
- 15) કંપની ઓડિટરની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ ?
- (A) C.A.
(B) M.C.A.
(C) M.B.A.

વિભાગ - B

- નીચે આપેલા 16 થી 30 પ્રશ્નોના અતિ ટૂંકમાં જવાબ લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

[15]

- 16) ઓચિંતી તપાસ એટલે શું ?
- 17) વેચાણવેરો ક્યારથી ઉઘરાવવામાં આવે છે ?
- 18) 2019-20 માટે આકારણી વર્ષ જણાવો.
- 19) ઓડિટ પ્રોગ્રામ એટલે શું ?
- 20) આંતરિક અંકુશનું એક લક્ષણ જણાવો.
- 21) ઉત્પાદન ગણાતી એક પ્રક્રિયા જણાવો.
- 22) ઓડિટરના કામકાજનું એક કાગળ જણાવો.
- 23) ઓડિટરનો એક ગુણ જણાવો.
- 24) વેચાણવેરો કાયદા મુજબ “ખેડૂત” એટલે શું ?
- 25) ઓડિટ કોણ કરે છે ?
- 26) આવકવેરાનો કાયદો કઈ સાલથી અમલમાં આવ્યો ?
- 27) પ્રથમ ઓડિટરની નિમણૂંક કોણ કરે છે ?
- 28) પ્રાયોગિક તપાસ એટલે શું ?
- 29) વેચાણવેરા ધારા હેઠળ “ધંધા” શબ્દનો અર્થ સમજાવો.
- 30) ઓડિટરના અહેવાલનો અર્થ આપો.

વિભાગ - C

- નીચે આપેલા 31 થી 44 ટૂંકમાં જવાબ લખો. દરેક પ્રશ્નનો 2 ગુણ છે. (ગમેતે 12)

[24]

- 31) વેચાણવેરા ધારા પ્રમાણે ‘વેચાણોનું ટર્ન ઓવર’ એટલે શું ?
- 32) ઓડિટીંગની વ્યાખ્યા આપો.

- 33) પાછલું વર્ષ એટલે શું ?
- 34) ઉત્પાદન ન ગણાતી બે પ્રક્રિયાઓ જણાવો.
- 35) ઓડિટ નોંધપોથીમાં સમાવેશ થતી બે વિગતો જણાવો.
- 36) નામા પદ્ધતિના બે ફાયદા જણાવો.
- 37) આકસ્મિક આવક એટલે શું ?
- 38) વેચાણવેરા ધારા હેઠળ જાહેર કરેલો માલ કોને કહેવાય ?
- 39) ઓડિટિંગની બે મર્યાદા જણાવો.
- 40) ઓડિટ કાર્યક્રમના બે ફાયદા જણાવો.
- 41) પગારની આવકના શિર્ષક હેઠળ સમાવાતી બે આવકો જણાવો.
- 42) ગુજરાત વેચાણવેરા સંદર્ભમાં “વેપારી” કોને કહેવાય ?
- 43) પડતર ઓડિટના બે ફાયદા જણાવો.
- 44) આંતરિક અંકુશ એટલે શું ?

વિભાગ - D

- નીચેના 45 અને 46 ટૂંકા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. દરેક પ્રશ્નના 3 ગુણ છે. [6]
- 45) કંપની ઓડિટરની ત્રણ ગેરલાયકાતો જણાવો.
- 46) ઓડિટિંગના ત્રણ લક્ષણો લખો.
- નીચેના 47 થી 50 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. દરેકના 4 ગુણ (ગમે તે ત્રણ) [12]
- 47) પડતર ઓડિટના હેતુઓ જણાવો.
- 48) કેન્દ્રિય વેચાણવેરા હેઠળના ગુના જણાવો.
- 49) ઓડિટ અહેવાલ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
- 50) પ્રાયોગિક તપાસના બે ફાયદા - ગેરફાયદા જણાવો.

■ નીચેના 51 અને 52 પ્રશ્નના તફાવતલક્ષી જવાબ લખો. દરેકના 4 ગુણ છે. [8]

51) આંતરિક અંકુશ અને આંતરિક ઓડિટ વચ્ચેના તફાવતના ચાર - ચાર મુદ્દા લખો.

52) નામા પદ્ધતિ અને ઓડિટિંગ વચ્ચેના તફાવતના ચાર - ચાર મુદ્દા લખો.

■ નીચે આપેલા 53 થી 58 નિબંધલક્ષી પ્રશ્નોના જવાબ આપો. દરેકના 5 ગુણ (ગમે તે ચાર) [20]

53) આવકના શિર્ષકો સમજાવો.

54) કંપની ઓડિટરની પાંચ સત્તા સમજાવો.

55) આંતરિક અંકુશના સિદ્ધાંતો જણાવો.

56) ઓડિટ અહેવાલના લાભ જણાવો.

57) ગુજરાત વેચાણવેરા સંદર્ભમાં નીચેના શબ્દોની સમજૂતિ આપો. (ગમે તે બે)

(1) કમિશન એજન્ટ

(2) ઉત્પાદન

(3) વેચાણ કિંમત

58) જોશ ભટ્ટ એક કંપનીમાં નોકરી કરે છે. નીચેની માહિતી પરથી ગ્રોસ આવકની ગણતરી કરો.

(1) વાર્ષિક પગાર રૂ. 1,80,000

(2) મોંઘવારી ભથ્થું પગારના 25%

(3) બોનસ એક માસનો પગાર

(4) માલિક દ્વારા પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 15% લેખે આપવામાં આવે છે.

(5) જીવન વિમા પ્રિમીયમ રૂ. 8,000

(6) મનોરંજન ભથ્થું માસિક રૂ. 400

